

# વિધાર્થી વાચનમાળા

શ્રેષ્ઠો ભૂમિ  
સંપાદક: જયલિખા

૧૪-૧૫૪

## દાર્જિલિંગ

લેખક:  
ત્રયભાઈ પટેલ



રૂ. ૦-૪-૦

૨૧૪૨

# વિ દ્વારી વાચન માળા.

છૂટક એક શ્રેણી ૩-૦-૦ પોસ્ટેજ પાંચ આના બધુ

∴ દશ શ્રેણીના એક સાથે ૩૦-૦-૦ ∴

પહેલી શ્રેણી	બીજી શ્રેણી ૪-૦-૦	ત્રીજી શ્રેણી
૧ શ્રીરામ	૨૧ આદકવિ વાહમાકિ	૪૧ મહામુનિ વિશિષ્ટ
૨ શ્રીકૃષ્ણ	૨૨ મુનિરાજ અગરસ્ય,	૪૨ મહાલસા
૩ લગ્વાન ખુદ્	૨૩ શકુનલા	૪૩ રાજકુમાર બુધ
૪ લગ્વાન મહાનીર	૨૪ દાનેશ્વરી કણ્ણ	૪૪ સતી સાવિત્રી
૫ વીર હનુમાન	૨૫ મહારથી અર્જુન	૪૫ દ્રોપદી
૬ લડનીર ભીષ્મ	૨૬ વીર અલિમન્દુ	૪૬ વીર વિક્રમ
૭ સતી હમયંતી	૨૭ સત્યવાહી હરિશ્ચંદ	૪૭ રાજ બોજ
૮ કચ-હેવયાની	૨૮ અક્તા પ્રહ્લાદ	૪૮ કવિ કાલિદાસ
૯ સત્રાટ અશોક	૨૯ પિતુલકાન શ્રવણ	૪૯ વીર હુર્ગોદાસ
૧૦ અફવર્તી અંગ્રેઝ	૩૦ ચેલીયો	૫૦ મહારાણા પ્રતાપ
૧૧ રાજ અર્થાદ્વિ	૩૧ મહાત્માતુલસીદાસજ	૫૧ સિકીમનો સપૂત્ર
૧૨ સંત તુકારામ	૩૨ ગોપીચંદ	૫૨ દાનબનીર જગઠુ
૧૩ અક્તા સુરદાસ	૩૩ સતી પદ્મિની	૫૩ સિદ્ધરાજ જયચંદ
૧૪ નરસિંહ મહેતો	૩૪ સ્વામી રામકૃષ્ણ	૫૪ જગતશેઠ
૧૫ મીરાંબાઈ	૩૫ સ્વામી વિવેકાનંદ	૫૫ પંડિત મોતીલાલજ
૧૬ સ્વામી સહનાનંદ	૩૬ સ્વામી રામતીર્થ	૫૬ સરજગીશચંદ્રોજ
૧૭ શ્રીહ્યાનંદ સરસ્વતી	૩૭ શ્રીમહ રાજચંદ	૫૭ શ્રી અરવિંદ બેષ
૧૮ દોઢીમાન્ય ટિળક	૩૮ પંડિત મહનમોહન માલવીય	૫૮ વીર વિઠુલભાઈ
૧૯ મહાત્મા ગાંધી	૩૯ સરદાર વલ્લભભાઈ	૫૯ પ્રે. દેંડો કેસન ફેં
૨૦ સ્વીન્દ્રનાથ ટાગોર	૪૦ શ્રીમતી સરેણિની નામકુ	૬૦ શ્રી અનીબેસન્ટ

શશ્વત્તારીદ્વારા પ્રસાદી

વિદ્યાર્થી વાચનમાળા : અણુ આડમી : ૧૪-૧૫૪

## ગિરિનગર દાર્જિલિંગ

સિમલા, મસુરી, નૈનિતાલ અને દાર્જિલિંગ  
હિમાલયના પ્રહેશમાં વસેલાં ઉત્તર હિન્દનાં મુખ્ય  
ગિરિનગરો છે. એમાં કયું વધારે સુંદર એ  
કહેવું કઠિન છે, કારણ કે સહુમાં હિમાલયનું  
કુદરતી સૌંદર્ય છે, ઉચ્ચ પ્રહેશની શીતલતા છે,  
અને પહોડી ભૂમિની વિવિધતા છે. છતાં  
સિમલાના પ્રશાંસકોએ "સિમલાની અનુદાર્જિ-  
લિંગના પ્રશાંસકોએ દાર્જિલિંગને The Queen  
of the hill-stations એટલેજિકે ના હિન્દનાં ગિરિનગરેની  
રાણી." એવા નામશી સંઘ્યાધ્યાં છે.

હિન્દમાં પહેલાં ગિરિનગરની હતાં.  
અંગ્રેજોના અમલ પદીથી એ અસ્તિત્વમાં આવ્યાં.  
કારણ કે અંગ્રેજો ઠંડા પ્રહેશના રહીશો રહ્યા. હિન્દ-  
નાં મેદાનોની ઉનાળાની અસહ્ય ગરમીમાં તેઓ



૪૮૩  
jir@kobatirth.org તું? એ ઉનાળાની શરૂઆતમાં અંગેજ અમલદારોને પાસેના દુંગરાયોની ઠંડી ટેકરીએમાં જવું રહ્યું. આમ ટેકરીએ ઉપર ગિરિનગરોની આવશ્યકતા ઊભી થઈ, અને પ્રાન્તે પ્રાન્તે ગિરિનગરો થયાં.

હિન્દમાં આજનાં ગિરિનગરો નહતાં, એટલે અમ ન સમજવું કે હિન્દીએને એ પહાડી સૌંદર્યના શોખ ન હતો, એ માટેનું આકર્ષણું ન હતું. ગિરિનગરોને બદલે પહાડે પહાડે પવિત્ર સ્થળો પરાપૂર્વથી જ્ઞેવામાં આવે છે. કાઠિયાવાડનાં ગિરનાર, પાલીતાણા; આખુ પરનાં જૈનમંહિરો, ધ્યારા અજનયાની પહાડીભૂમિમાં આવેલી ગુફાએ, અને હિમાલય પરનાં હરદ્વાર, બદ્રિનાથ અને કેદારનાથ એ શોખનાં સાક્ષીકૃપ છે.

દાર્જિલિંગ બંગાળાની ઉનાળાની રાજધાની છે, કલકત્તાથી એ ઉત્તે માઈલ ઉત્તરે આવ્યું છે. આપણા ગુજરાતમાંથી દાર્જિલિંગ જવું હોય તો મુંખદથી કલકત્તા થઈને જવું સુગમ પડે. કલકત્તા મુંખદથી ૧૨૨૩ માઈલ હૂર છે, એટલે મુંખદથી દાર્જિલિંગનું અંતર ૧૬૦૮ માઈલનું થાય. લગ-ભગ ૪૦ કલાકુમાં રેલવેરસ્તે આ મસાફરી પૂરી થાય.

## દાર્જિલિંગના રસ્તામાં

આપણું ગુજરાત હિન્દના પશ્ચિમ કિનારે રહ્યું, જ્યારે દાર્જિલિંગ ધીશાન ખૂણુભાં આવ્યું. એટલે દાર્જિલિંગના મુસાફરને આખાયે હિન્દની મુસાફરી થાય. ગજરાતની રસાળ ભૂમિ, મુંઘઠના દરિયાકિનારાનો પ્રદેશ, પાશ્ચમધાટના રણિયામણા દુંગરા, અને મધ્ય હિન્દની ખીણો તથા ઉચ્ચ ભૂમિ વટાવી, એ દૂર પૂર્વમાં કલકત્તા સુધી આવી પહોંચે છે. કલકત્તા છોડી દાર્જિલિંગ જતાં પ્રથમ તો ગંગાનાં સપાઈ ફુણ્ણુપ મેહાનો આવે. આગગાડીની ખારીમાંથી ડાઢિયું કરો તો દૂર નજર પહોંચે ત્યાં સુધી શાણ કે ડાંગરનાં એતરો જ દષ્ટિએ પડે. દુંગરા કે એકરીઓનું નામ ન મળે. ગંગાની ખીણ વટાવી એટલે હિમાલયનાં ચઢાણું ચઢવાં શરૂ થાય. આમ ગુજરાતમાંથી દાર્જિલિંગ જનારની આંખ નીચે હિન્દના વિવિધ પ્રદેશો આવી જય.

પહેલાં ઠેઠ દાર્જિલિંગ સુધી આગગાડી ન હતી, એટલે મુસાફરોને ધણી મુશીબત પડતી. સરસામાન સાથે માઈલો સુધી ગાડામાં ને હોડકામાં મુસાફરી કરવી પડતી. એની મુશ્કેલીનો જ્યાલ તો એવી સફર બ્લેણો કરી હોય તેને જ આવે.

હિમાલયના ઢોળાવ ચઢવા માટે આજે તો રેલવે છે. આ રેલવેનો સાધારણ ખ્યાલ જેણે નેરલથી ભાથેરાનની મુસાક્ફરી કરી હશે તેને આવી શકશે. નાના પાઠા-ઈક્ઝટ એ ક્રીટના અંતરે, પર્વતોની ખીણો અને ટેકરીઓ વટાવતા ચાલ્યા જ જય. પર્વતોમાં ખાંધેલી આવી રેલવેને Mountain Railway એટલે કે પર્વતોની રેલવે કહેવામાં આવે છે.

કલકત્તાથી જતાં આ રેલવેનું પહેલું સ્ટેશન સીલીગુરી છે, અને છેલ્યું હાર્બિલિંગ છે. ઘને વચ્ચે ૫૧ માઇલનો રસ્તો છે. આ ૫૧ માઇલનો રસ્તો હુનિયાના રેલવેના રસ્તાઓમાં અનેડ છે. ભલભલા ઈજનેરોને એ આશ્રય પમાડે છે. હુનિયાના ઊચામાં ઊચ્ચો પર્વત તે હિમાલય. એ હિમાલયના દુંગરા, ખીણો અને વેગવાન વહેળાઓ ઉપર થઈને રેલવે ખાંધવી, એ તો કૃપું જ કામ ને!

આ રેલવે ખાંધવાની શરૂઆત ઈ. સ. ૧૮૭૮ માં થઈ. એ વરસ સતત કામ ચાલ્યું, અને ૧૮૮૧ માં પૂરી થઈ. એની ઉદ્ઘાટન-કિયા એ વખતના બંગાળાના લેફ્ટેનન્ટ ગવર્નર સર એસલી એડનના હાથે થઈ. આ રસ્તો ખાંધતાં હર માઇલે ૪૭૦૦૦ રૂપિયા જેઠલો ખર્ચ થયો છે. આ ખર્ચના આંકડા-

આજ આ રેલવેની મહત્તમાનો ઘ્યાલ આપે છે.

હાજીલિંગનો જડપી વિકાસ આ રેલવેને આભારી છે. કારણ કે સ્થળ ગમે તેઠલું સુંદર હોય છતાં ત્યાં જવાની મુરકેલી પડે તો ધણૂં જ થોડા માણુસો એ સ્થળે જવાની હિંમત ધરે; અને જ્યાં ગણુંગાંઠી વ્યક્તિએ જય તે સ્થળે આજના હાજીલિંગ જેવું વિશાળ ગિરિનગર તો ન જ વસી શકે.

સીલીગુરીથી હાજીલિંગ સુધીનો પ્રદેશ ધણૂં જ રમણીય છે. ‘દુંગરા હૂરથી રળિયામણૂં’ એ કથન આ પ્રદેશ ઝાડું પાડે છે. અહીંથી હિમાલયની શરૂઆતથાય છે, પરંતુ એ ગિરિરાજની મુખ્ય હારમાળાએ જેટલા એ જીંચા નથી. હિમાલયનાં ગગનચુંબી શિખરો તો આ દુંગરાએની પાછળ રહ્યાં, એટલે ચોમાસામાં અહીં ધોધમાર વરસાદ પડે. વરસાદ દુંગરાએની સિક્કલ ફેરવી નાએ છે. એ વરસાદ ન હોત તો આ આણો પ્રદેશ વેરાન ઘનત, પરંતુ આજે તો એ જંગલોથી ભરપૂર છે. ગાડી એક ઢોળાવ પર આવે, ત્યાં તો હૂર હૂરની હરિયાળી ભૂમ દેખાય, આસપાસનાં જંગલનાં જીંચાં જીંચાં વૃક્ષો જણાય. નીચે ખીણોમાં હોડતી

કૂદતી વહી જતી નહીંએ જણ્ણાય, અને કોઈ કોઈ જગ્યાએ નાના નાના ધોધ પણ હોય. આ સધળું જેતાં આંખ ધરાય નહિ. બારીમાંથી અંદર ડોકું લેવાનું મન જ ન થાય. ખરેખર આવી મુસાજીરી એ જીવનનો અનેરો લહાવો છે.

આ જંગલોનો પ્રદેશ તેરાઈના નામથી એણ-ખાય છે. અહીં હાથી, વાધ, હરણ, રીછ, અને ચિતા જેવાં વન્ય પણુંએ પુષ્ટળ છે. સાલ, સાગ, વાંસ, ધનિયા રઘુર અને એકનાં જાડ પણ અહીં ધણું. બરુના છોડ તો પચાસ પચાસ કુટની શિંચાઈએ પહોંચેલા. એ પરથી જંગલ કેટલું ગાડું હશે તેનો ખ્યાલ આવશે. આ વનસ્પતિમાં વિવિધતા ધણી છે. કારણ કે જેમ જેમ જીંયે ચઠીએ તેમ તેમ હવામાન ઠંડું થતું જય, અને હવામાન બદલાતાં જાડ પાન પણ બદલાય. આ સર્વ જાડને એણખ-વાં, અને એના ગુણ-દોષ જણુવા એ તો જીવનભરના અલ્યાસનું કામ છે.

આ પ્રદેશના દર્શાંકને એક બીજે પણ ખ્યાલ આવે. હિન્દમાં કોલસો નથી માટે અહીં મોટા મોટા ઉદ્ઘોગો ચાલી ન શકે, એવી દલીલ કરનાર પરદેશીએને આ પ્રદેશનાં નહીં-નાળાં જવાબ આપી ઊઠે છે કે બદે

હિન્દમાં કોલસો નહિ હોય, પરંતુ વીજળીક ખળ ઉત્પન્ન કરવા અમારાં હજરો નહીએ ને નાળાં રાતદિવસ વહી રહ્યાં છે. આ જંગલોની નીરવ શાંતિમાંથી રેલ્વે ટ્રેનનિ પસાર થાય છે ત્યારે મુસાફરના મન પર કંઈ જુહી જ છાપ પડે છે.

ડુંગરાએ ચઢતી અને ઊતરતી ગાડી ૪૮ માઈલનો રસ્તો કાપે, ત્યાં ધુમ સ્ટેશન આવી લાગે છે. ધુમ સમુદ્રની સપાઠીથી ૭૪૦૭ ફૂટ ઊંચું છે. દાન્જિલિંગની આજુબાજુના ઢોળાવો પર ચાના ખગીયાએ છે. એ બાળોની ચા ધુમના સ્ટેશનેથી કલકત્તા રવાના થાય છે. ધુમની ઊંચાઈ ધણી એટલે સવાર-સાંજ અહીં લેજને લીધે પુષ્કળ ધુમમસ વરસે છે. એ ધુમમસને લઇને રસ્તો શોધવો પણ ભારે પડે.

ધુમથી દાન્જિલિંગ ફૂકત ત્રણ-ચાર માઈલ દૂર રહ્યું. ધુમ છાડીને આગગાડી નીચલા ઢોળાવો પર ઊતરવા માંડે છે. થોડુંક ઊતરે, ત્યાં તો મુસાફરને દાન્જિલિંગનાં પ્રથમ હર્ષન થાય છે. રાત્રિનો સમય હોય, સર્વત્ર શાંતિ હોય અને આ ઢોળાવ ઊતરતાં ખંગલાએ અને ખજરોની હીવા-ઘતીએ હેખાતી હોય, ત્યારે દાન્જિલિંગ ધાણું જ

સુરોભિત લાગે છે.

સીલીગુરીથી દાન્જિલિંગ જવા મોટર-રસ્તો પણ છે. આ રસ્તો અને રેલવેરસ્તો લગભગ સાથે સાથે જય છે. મોટર કે ઘસમાં જતાં મન ધર્ણી પડે છે, પરંતુ જગા મળવાની હમેશાં મુશ્કેલી રહે છે. આગળથી સીલીગુરીના સ્ટેશન માસ્તરને જણા-વ્યાથી મોટર કે ઘસમાં જગા સુકરર કરી શકાય છે.

### વસ્તી અને હવામાન

દાન્જિલિંગમાં લગભગ ૨૦૦૦૦ની વસ્તી છે. એ વસ્તીમાં ૧૨૦૦૦ જેટલા હિન્હુએ છે, તથા ૫૦૦૦ જેટલા ઘોડ ધર્માએ છે, બાકી રહ્યા તે મુસલમાન અને પ્રિસ્ટિએ. આ ઉપરથી જણાશેકે દાન્જિલિંગની સ્થાનિક વસ્તી કંઈ નાની નથી.

આખા હિંદની માર્ક અહીં પણ ત્રણ ઝડતુએ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં અતિશય ઠંડી પડે, ચોમાસામાં પુષ્કળ વરસાદ પડે એટલે આ ઝડતુએમાં ઘણારના આવનારાએ તો ન જ આવે. તેએ તો ઉનાળામાં જ્યારે મેદાનોના પ્રદેશમાં અસહ્ય ગરમી પડે ત્યારે જ અહીંની શીતલ ટેકરીએના પ્રદેશમાં આવે. આથી દાન્જિલિંગની વસ્તી ઉનાળામાં ધર્ણી વધી જય છે.

અહીંની સ્થાયી વસ્તી આષટ્ઠી મોટી હોવાને કારણે દાનિલિંગ બીજાં ગિરિનગરોથી કેટલીક રીતે જુદું પડે છે. આ ગિરિનગરમાં ખાલમંહિરો ધણ્ણાં છે. શાળાઓ પણ એટલી ૭, અને કોલેજે પણ સારા પ્રમાણુમાં, એથી એ એક કેળવણીનું કેન્દ્ર બની ગયું છે. દરહીઓ માટે હોસ્પિટ્લો, મુસાફરોની જરૂરીઓતો માટે બજારો અને દુકાનો અહીં ધણી છે.

દાનિલિંગની ઊંચાઈ સમુદ્રની સપાઠીથી ૬૫૦૦ થી ૭૫૦૦ ફીટ સુધીની છે. આર્થી શહેરનો કોઈ ભાગ ઊંચાણુમાં તો કોઈ નીચાણુમાં છે. આટલી ઊંચાઈને લઈને હવા ઠંડી રહે છે. ઉનાળાના સખત તાપમાં અમહાવાહ, વડોદરા જેવાં આપણાં ગુજરાતનાં શહેરોમાં ૧૦૦થી ૧૧૦ ડીંબી જેટલી ગરમી પડે ત્યારે અહીંથાં ૭૦ ડીંબી કરતાં વધારે ગરમી હોતી નથી. શિયાળામાં અહીં અતિશાય ઠંડી પડે છે. ઠંડીનું પ્રમાણું ૫૦ ડીંબી જેટલું એછું થાય એટલે ગુજરાતમાં તો હીમ પડવું શરૂ થાય, એતરોના ઊભા છોડ ઠંડીથી બળી જાય, પરંતુ એકટોબ્બર મહિનો પૂરો થાય અને નવેમ્બરની શરૂઆત થાય ત્યાં દાનિલિંગમાં ઠંડી પડવા માંડે. શિયાળો

અધ્યવારતાં તો થર્માભીએરનો પારે છેક ઉપ ડિગ્રીએ  
આવી રહે. આખા વરસની સરાસરી ગરમી કાઢીએ  
તો લગભગ ૫૬ ડિગ્રી સુધીની થાય. મુસાફરોને  
માટે શિયાળો દાર્જિલિંગ જવા આમ નકામો છે.

ચોમાસું પણ નકાસું. ચોમાસામાં આકાશ  
વાદળાંથી ઘેરાયેલું રહે, ધૂમમસ પણ ખૂબ્ય  
પડે, એટલે દાર્જિલિંગમાંથી જેવાતાં હિમાલયની  
હિમાન્ધાહિત ગિરિમાળાઓનાં અહૃદ્ભુત દર્શયો પ્રેક્ષ-  
કાને ન હેખાય. વરસાદ પણ એટલો જી. ગુજરાતમાં  
વરસાદની સરાસરી ૩૦ થી ૩૫ ઈંચ સુધીની આવે  
ત્યારે અહીં ૧૨૦ ઈંચ જેઠલો વરસાદ પડે છે.  
વરસે ત્યારે એ ધોધમાર વરસે છે. છતાં પાણી  
ક્રયાં વહી ગયું તે જણ્ણાતું નથી. ટેકરીએના ઠોળાવ  
પરથી વરસાદના એ પાણીને ખીણોમાં સરી પડતાં  
વાર લાગતી નથી. પાણી ભરાઈન રહે એટલે આન્જુ-  
આન્જુના પ્રહેશમાં આવાં ગીચ જંગલો હોવા છતાં  
દાર્જિલિંગમાં મંચછરોનો અઝો ઉપદ્રવ નથી. ઉના-  
મામાં હવા ખુશનૂમા રહે છે. એટલે જ ઉનાળો  
દાર્જિલિંગ આવનારાએને ધણો અનુકૂળ થઈ પડે છે.  
હોટેલો અને રસ્તાએ

ગિરિનગરો પર પાશ્ચાત્ય સંસ્કૃતિની છાપ છે,

એટલે આવાં સ્થળોમાં ધર્મશાળા કે મુસાફરખા-  
નાંઓને બદ્દલે પશ્ચિમની ફેદે ચાલતી હોટેલો વિશેષ  
હોય છે. માઉન્ટ એવરેસ્ટ, પાર્ક, ગ્રાન્ડ અને  
સેન્ટ્રલ, હિંદુભરમાં પંક્તાયેલી દાન્જિલિંગની હોટેલો  
છે. ઉત્તરવા માટે આ હોટેલોમાં સુંદર સગવડતા  
હોય છે, પરંતુ સામાન્ય માણુસને આ હોટેલોનો  
ખર્ચ ન પોષાય એટલે એમણે તો જુદી જ વ્યવ-  
સ્થા કરવી રહી.

ગિરિનગરોમાં મુસાફરો હવાક્રેન માટે આવે  
છે, તંહુરસ્તી માટે આવે છે, સૃષ્ટિસૌન્દર્યમાં વિહાર  
કરવા આવે છે, થોડાક હિવસના એશાચારામ માટે  
પણ આવે; આ સર્વ માટે દાન્જિલિંગ આહર્શ સ્થળ  
છે. સધળી જતની અનુકૂળતાએ અહીંથાં મળી  
રહે છે. રખડવા માટે માઈલો સુધી અહીં લાંબા  
રસ્તાએ છે. આએ હિવસ એ રસ્તાએ પર છાંયડો  
રહે છે, હવા પણ ઠંડી, એટલે ગમે તેટલું ચાલીએ  
પણ થાક જણાય જ નહિ. અને થાકલાગે તો વાહનો  
પણ મળી રહે. રિક્ષામાં અને ધોડાએ પર કેટલાય  
મુસાફરો અહીં ફૂરતા જણાય છે. પરે ચાલનારા-  
આનો તોટો નહિ. એમને માટે મોટા રસ્તાએને  
બેડી પગદંડી અને નાના રસ્તાએ પણ ખરા. પરે

રખડનારાઓની સંરોધનવૃત્તિને આ રસ્તાઓ ઉત્તેજે છે.

દાન્બિલિંગ એક વિશાળ ટેકરી પર વસ્તું છે. એ ટેકરી ઉત્તરમાંથી દક્ષિણ તરફ જય છે. એટલે શહેરની ઉત્તર-દક્ષિણ લંબાઈ ધણી છે. જ્યારે પૂર્વ પશ્ચિમ પહોળાઈ ઓછી છે. આ ટેકરી પર દાન્બિલિંગના સધળા રસ્તાઓ આવેલા છે. એ રસ્તાઓ એકખીબથી લગભગ સમાંતર ઉત્તરથી દક્ષિણમાં જતા જણ્યાય છે.

દાન્બિલિંગનો સૌથી મોટો રસ્તો તે કાઈ રોડ. એ છેક પાશ્ચમમાં છે અને માઈલો સુધી રેલવેની સાથોસાથ ચાલ્યો જય છે. એ જ રસ્તો દૂર ઉત્તરમાં જઈ લેખાંગ કાઈ રોડ નામ ધારણું કરે છે અને પૂર્વમાં વળે છે. ત્યાંથી એ છેક રેસ કોર્સ સુધી જય છે. જ્યારે ઘોડાની શરતો થવાની હોય છે ત્યારે આ રેસકોર્સ માણુસોથી ઉભરાય છે. ઉત્તરને છેડે આ રેસકોર્સ છે, જ્યારે શહેરને દક્ષિણ છેડે જેર બંગલો છે. રેસ કોર્સ આગળથી રંગિત રોડ નીકળે છે, જ્યારે જેર બંગલા આગળથી કાઈ રોડમાંથી કલકત્તા રોડ ફૂંટાય છે.

રંગિત રોડ અને કલકત્તા રોડ એ દાન્બિ-

લિંગના છેક પૂર્વના ધોરી રસ્તાએ છે. એ બન્ને રસ્તાએ ચોરસ્તામાં મળે છે. ચોરસ્તા આ શહેરનું મોકાનું સ્થાન છે. અહીં ધણા રસ્તાએ મળે છે. ચોરસ્તાની આજુખાજુ વિશાળ હુકાનો આવી રહેલી છે. જલપહાર રોડ, કેમર્સિયલ રોડ અને એફલેન્ડ રોડ અહીંથાંથી ફંટાઈ હક્કિણું તરફ જાય છે. જ્યારે ઇસ્ટ મોલ રોડ અને વેસ્ટ મોલ રોડ, ઉત્તર તરફ જાય છે. આ બન્ને રસ્તાએ ભેગા મળી ગવર્મેન્ટ હાઉસ તરફ જવાનો રસ્તો બને છે. એ રસ્તો તે વેસ્ટ બ્ર્યાન્ડ હીલ રોડ. આ જ રસ્તો પૂર્વમાં વળે છે ત્યારે ઇસ્ટ બ્ર્યાન્ડ હીલ રોડ નામ ધારણ કરે છે. છેવટે એ પેલા રંગીત રોડને મળી જાય છે. આ રસ્તાએ હાજીલિંગને વીંટળાઈ વળે છે. આમાંના કેટલાક ઉપર મોટર બસ અને મોટર ગાડીઓની સગવડ હોય છે. છાંયડાને લીધે એ મજનાં લાગે છે.

### જેવા જેવાં સ્થળો

આ રસ્તાએ પર એકાદ પખવાડિયું રખડનારને ધુમ રસેશન, જલપહાર, ટાઉનહોલ, ટાઇગર હીલ, લેણાંગ, સ્લૂલસ્લૂલાણી-મ્યુઝીયમ, ગવર્મેન્ટ હાઉસ, માઉન્ટ એવરેસ્ટ હોટેલ, એન સેનીટરી-

અમ, ઓણઅરવેટરી હીલ, એટાનીક ગાડ્સ, બજાર, ભૂતિયા બસ્તી, ચિલ્ડ્રન્સ પ્લેઝન્સ, પાવર હાઉસ, વોટર વક્સસ વગેરે નામો કંઠસ્થ થઈલય છે. રમતગમતના સ્થળો ઉપરાંત હાર્જિલિંગનાં આ રમ્ય સ્થાનો છે. અહીંથાં સુસાફરોને ધણું જેવાનું અને જાણવાનું મળી રહે છે.

### ઓણઅરવેટરી હીલ

હાર્જિલિંગમાં ધણીય ઊંચી ટેકરીએ હશે, તેમાંની આ એક છે. સવાર-સાંજ આ ટેકરી પર માણુસોની મેદની જમે છે. આવનારા સધળા પ્રેક્ષ-કાનું ચિત્ત દૂરથી દેખાતાં હિમાચાદિત હિમગિરિનાં શિખરો પર ચોંટેલું હોય છે. હિમાલયનાં શિખરોનાં સુંદર દરશ્યો અહીંથી જેવાનું મળે છે. જ્યારે આકાશમાં વાદળાં ન હોય અને સર્ય ઊગતો હોય કે આથમતો હોય અને એ સૂર્યનાં બાલકિરણો સામેના પર્વતોનાં ઊંચાં શુંગો પર પડતાં હોય અને શિખરો પરના બરકુથી ભાતભાતના રંગ ઊઠતા હોય એ વખતનું દરશ્ય અહૃભુત ઘની રહે છે. એ પ્રદેશમાં પણ ઉપાના આવા રંગો જેવાના મળે છે. તેમાં વળી પૂણીમા હોય, પશ્ચિમમાં સૂર્ય આથમતો હોય, અને પૂર્વમાં ચંદ્ર ઊગતો હોય, ત્યારે

અહીંની શોભા ધણી વધી જય છે. આ દશ્યને આદેખવા રંગ કે શપદો શક્તિશાળી નથી.

હિમાલયનાં કેટકેટલાંય શિખરો ૧૬૦૦૦ ફીટથી ઊંચા છે. આ સધળાં શિખરો પર બરકુ હમેશાં જમેલો હોય છે, કારણું કે ૧૬૦૦૦ ફીટની ઊંચાઈએ હિમાલયમાં હિમરેખા આવી રહી છે. આવાં ધણું શિખરો આ ટેકરી ઉપરથી જણાય છે. આ સર્વ શિખરોમાં કાંચનગંગાનું શિખર એની ઊંચાઈથી, એની પરના બરકુમાં ઊઠતા ભૂરા રંગના એના ખડકોથી જેનારને સ્પષ્ટ જણાઈ આવે છે. કાંચનગંગાની હિશામાં દાઢિ નાખો અને નીચેથી જુઓ તો, નીચે આસપાસના જંગલોમાં વિશાળ વૃક્ષો જણાશે અને એનું ઊંચું હિમભય શિખર જણાશે. એજેતાં સહેજ મનુષ્યને કુદરતની સુંદરતા અને વિશાળતાનો સાક્ષાત્કાર થશે, પૃથ્વી ઉપર જે કોઈ સુંદરમાં સુંદર સ્થળ હશે તો તે આ જ છે, એમ એ જરૂર માની લેશે.

આ ટેકરી પર એક મઠ હતો, એનું નામ ડાર્જ-લિંગ હતું. ડાર્જનો અર્થ તિણેટી ભાષામાં મેધધનુષ્ય અને લિંગનો અર્થ સ્થાન થાય છે. આખા શપદનો અર્થ મેધધનુષ્યનું સ્થળ થાય. મેધધનુષ્ય-

ના રૂપેરી રંગો અહીંથી જેવાના મળે એટલે કદાચ એ મઠનું આ નામ રાજ્યું હોય. દાર્જિલિંગ નામ આ ગિરિનગરનું શાથી પડ્યું એ માટે કેટલાક મતો છે, પરંતુ ધણુંઘોનું માનવું છે કે આ મઠના નામ પરથી શહેરનું નામ દાર્જિલિંગ પડ્યું.

૧૮ મી સહીના પ્રથમ વરસોમાં નેપાળના ગુરખા-એએ જ્યારે દાર્જિલિંગ પર સ્વારી કરી ત્યારે આ મઠનો નાશ કર્યો. છતાં હજુ એ એની પુરાળી પવિત્રતા જળવી રહ્યો છે અને પર્વને દિવસે આજુખાજુના પ્રદેશના સેંકડો ઐદ્ધધર્મન્યો અહીં દર્શનાર્થે આવે છે. આ જ મઠની પાસે એક ગુરુનું દ્વાર છે. એ ગુરુ અહીંથી તે ઠેઠ દહાસા સુધી જય છે એમ અહીંના ભૂતીઓએ કે લેપચાઓ માને છે.

આપણા ગુજરાતમાં ઐદ્ધધર્મન્યોનો મઠ ન મળે, એટલે આ મઠમાં થતી કેટલીક ધાર્મિક કિયાએ જેવામાં આપણને મજન પડે છે. જ્યારે કોઈ ભાવિક ભક્ત મઠમાં આવે ત્યારે ધર્મગુરુ લાભા ધંટ વગાડે છે અને મંત્ર ભણે છે. મંત્ર ભણી રહે એટલે રક્ષાભીમાં કૂલ મૂકી એક વાસણુમાંથી એમાં હૂધ રેડે છે, પછીથી પેલા ભક્તના જમણા અને ડાખા ખબા પર ચંહનનો લેપ કરવામાં આવે છે અને હૂધ-

નું આચમન કરાવવામાં આવે છે. એ હૂંધ ભક્તના શરીર પર લામા છાંટે છે. ત્યારથાદ એ લામા થોડુંક રંગીન ઊન લે છે, યજ્ઞની વેહીની સામે ધરે છે અને મંત્ર બણે છે. એ મંત્રેલું ઊન ભક્ત સાથે લઈ જય છે અને જગતની રાખે છે. જતાં પહેલાં હેવળની સાતવાર પ્રદક્ષિણા કરે છે અને લામાને હાન આપે છે.

યજ્ઞની વેહી પાસે પરધમીઓ જઈ ન શકે એટલે આ સધળી ઢિયા બહારથી જ જેવાની હોય છે. એ વેહીની આજુખાજુ વાંસ બાંધેલા હોય છે. એ વાંસ પર વાવટાઓ ફરકે છે. બારીકાઈથી જેશો તો વાવટાઓ પર પ્રાર્થનાઓ લખેલી માલમ પડશે. આ લોકો માને છે કે પવનથી વાવટો હાલે એટલે પ્રાર્થના કરી કહેવાય. જેટલી વખત એ વાવટાઓ ફરકે તેટલી વખત પ્રાર્થનાઓ થાય. પ્રાર્થના કરવાની કેવી વિચિત્ર પ્રથા !

ઓછધમીઓનો આવો જ એક મઠ લેખાંગ પાસેના ભૂતીઓ ખસ્તીમાં છે. ભતીઓ ખસ્તી એ આ પ્રદેશના લેપચા; ભતીઓ અને લિંખુ લોકોનું નાનું ગામહું છે. આ ગામહું દરેક પ્રેક્ષકે જેવા જેવું છે. એ જેતાં આ લોકોના ધણું રીતરિવાજે તથા રહેણીકરણીની આપણું જાણું થાય છે.

## ચિલ્ડન્સ પ્લેઝન્સ

ચિલ્ડન્સ પ્લેઝન્સ, એ બાળકો માટેનું કીડાંગણું છે. એથે અખર્વેટરી હીલની પાસે જ એ આવેલું છે અને અહીં એકર જેટલો એનો વિસ્તાર છે. સુંદર ફૂલના કથારાએ અને નાના નાના ઝડનાં ઝુંડ એ એની વિશેષતા છે. બાળકોને રમવા-ખેલવા અહીં ધણી સગવડતા છે. એ નિર્દ્દેખ બાળકોને ખેલતાં જેઈ સર્વેને પોતાનું બાલપણું યાદ આવે છે. ઐન્ડના દિવસે અહીં માણુસોની મેહની જમે છે.

## ટાઉન હોલ

ગાંમડાંએની ભંદિરની ધર્મશાળાએનું સ્થાન શહેરોમાં ટાઉન હોલે લીધું છે. સભાએ ભરવી, મેળાવડાએ કરવા, નાચગાનના જલસા કરવા દાજીલિંગમાં પણ ટાઉન હોલ છે. ચો-રસ્તા-માંથી સ્ટેશનને જતાં એ માર્ગમાં આવે છે. એની સુંદર ગોથીક રચનાથી આસપાસનાં સધળાં ભકાનોમાંથી એ તરી આવે છે. કૂચયિહારના મહારાજાએ પોતાના પિતાના સ્મરણાર્થે એ ઘંધાવ્યો છે.

## ખંબર

ખરું દાજીલિંગ તો અહીંના ખંબરમાં જેવા

મળે છે. રવિવારે એ ખજર ભરાય છે. કારણું એ દિવસ રજનો વાર રહ્યો. આખા જિલ્લાની પચરંગી વસ્તી આ ખજરમાં લેગી થાય છે. અહીંથાં તિષેટમાંથી તિષેટીઓ આવે, આસપાસના ભૂતીઓ અને લેપચાઓ આવે, બંગાળીઓ અને મારવાડીઓ પણ હોય. સૌ પોતપોતાની વસ્તુઓ જમીન પર પાથરી એસે અને ઘરડકોને મોટેથી બુમ પાડી બાલાવે. અવાજ એલો બધો ઊઠે કે ડાન પડ્યું પણ સંભળાય નહિ. આ ખજરની આજુબાજુ દેશી હુકાનોની હાર છે અને હારમાં એક સુંદર ધુમમટવાળું હિંદુઓનું હેરું છે.

મોટા મોટા ખજરોમાં પણ ન મળે એવી પચરંગી ચીજે અહીં વેચાય છે. અહીંથાં આવે તિષેટથી તાંખા-પિતળનાં વાસળો, હિંદી, ચીનાઈ અને જપાની ચાંદીની કારીગરીના નમુનાઓ, લોઢાનો સરસામાન પણ એલો જ. એક બાજુ શાલ, ઊનના ધાખળા, વ્યાધચર્મો, દવાદારૂ અને ગાંધીવસાણુની ચીજેના દેગલા પણ ખડકાયેલા જ હોય. પરંતુ એ સર્વમાં પેલા બૈન્દ દેવાલયોમાં જેવામાં આવતાં ગ્રાર્થના-

ચક્રો સુસાફરોનું ધ્યાન એંચે છે. ખજરમાં ગાતાં  
ગાતાં જતાં આવતાં આ પહાડી લોકોનાં ટોળાં-  
ઓનું દર્શય સુસાફરો જરૂર ભૂલી ન શકે.

### લોકો

આ પ્રદેશના લોકો હિંદીઓથી જુદા પડે છે.  
હિંદીવાનો આર્ય જલિના છે. જ્યારે આ લોકો  
માંગોલીઅન જલિને મળતા છે. એમના ચહેરા  
ચપટા, આંચ્છા તરંગી અને નાક સીહીઓની  
માઝુક ચીણાં હોય છે. પહાડી ભૂમિમાં વસવા છતાં  
પઢાણો જેટલા ઊંચા જખરા નથો. ઊલટું ટીંગણૂં  
છે, છતાં ખળવાન તો ખરા જ. એમની મુખ્ય એ  
જલિએ છે. ભૂતિયા અને લેપચા. નેપાલી અને  
તિષ્ઠી પણ અડીંચાં ધણા મળી આવે.

દાર્જિલિંગમાં રખડતા હો અને જે કોઈ  
ટોળામાં કાળી મેંશથી રંગેલા કાળા મોઢાવાળી  
બાઈ જુએ તો સમજજે કે તિષ્ઠીઓઓનું હોળું  
છે. હુનિયાના સર્વ દેશોની સ્ત્રીએ જોરી દેખાવા  
પકુ-પાઉડર કરે છે ત્યારે આ બાઈએ મોઢે મેશ  
ચોપડી ખજરે ચૈંટે કરે છે. એ સ્ત્રીએને ધરનો  
અને ખહારનો સધળો ધંધો કરવો રહ્યો, એટલે  
પોતાની સુંદરતા છુપાવવા આમ મોઢે મેશ ચોપ-

ડતી હોય.

આ તિષ્ણીએ ચાના બહુ દૃકી હોય છે. એમની ચા આપણી ચા કરતાં જુદી. આપણી ચા ધૂઠી હોય છે ત્યારે એમની ચાનાં ચોસલાં કરેલાં હોય છે. ચા ઘનાવતી વખતે ચોસલું કાપી તેને ખાંડી લોટ કરી નાએ. કીટલોમાં પાણી સાથે આ લોટ નાએ અને લાલ લાલ પાણી થાય ત્યાં સુધી ઉકાળે. પણીથી દૂધ સાથે માખણું પણું નાએ. માખણું વાળી ચા કેમ પીવાય? છતાં તેઓને તો આ ચા મળી એટલે જાણે બધું મહયું.

એમના પહેરવેશમાં લાંબો ઝલ્ભો અને કુમરપદ્ધો ખાસ જણાઈ આવે છે. ધરેણુંએના એ શોખીન હોય છે. સ્વીએની માફુક પુરણો પણ કાને એરીંગ પહેરે છે. ગળાના શાણુગારો પણ ભાત-ભાતના. રખડપદ્ધી એમના જીવન સાથે જડેલી છે. હિમાલયના પરકુમાં રખડતાં રખડતાં કેટલાય થીજ મરણુશરણ થાય છે. એમની પાસે જઈને જુએ તો એ ગંદા લાગશે, કેમકે સનાન જેવી વસ્તુનું એમના જીવનમાં સ્થાન નથી.

દાજીલિંગમાં નોકરની જરૂર લાગે તો બધા મુસાફરો ભૂતાની ભૂતિઆએને પસંદ કરે છે, કારણ એમને સધળું આવેદે. વાસણું ઉટકે, પાણી ભરે,

લાડાં ફાડે અને મજૂરની માફક ભાર પણ ઉપાડે. દારુની એમને ધણી લત લાગેલી હોય છે. ધણીય યુરોપિયન મુસાફરોએ પોતાના ખાટલા ખાલી થઈ ગયેલા જેથા હશે. આ ભૂતિઓએની ત્રણ જતિ છે. તિષ્ઠી ભૂતિઓ, સિક્કીમના ભૂતિઓ અને ભૂતાની ભૂતિઓ. પરંતુ એ સધળા મેંગો-લીએનોને મળતા. ભૂતિઓ સ્વીએ ધણી મહેનતુ હોય છે. કાંતણું અને વણાટ એમને હસ્તગત છે. એમના લેલી સહેલાઈથી એમના લેલું ઊનતું કાપડ લાગ્યે જ બનાવી શકાય. પાણીનું ડરી બરકું થઈ જય એવા ઢાંડા પ્રદેશમાં ઊનતું જડું કાપડ વણતાં તો આવડવું જેઈએ ને? આ પ્રદેશના પહાડી લોકો માથે વાળના ચોટલા ગુંથે છે પરંતુ ધણીય ભૂતિઓ સ્વીએ વાળ ધૂટા રાંબે છે. પવનથી ઊડતા ધૂટા વાળવાળી ઊન કાંતતી કાંતતી ચાલતી ભૂતિઓ બાઈએ દાજીલિંગના બજરમાં કંઈ જુદી છાપ પાડે છે.

હવે રહ્યા લેપચા લોકો. દાજીલિંગના ધારાવાળા રસ્તાએને એક ખણે ઐસી જુગાર ખેલતા માણુસોનું ટાળું જુએ. તો જાણું કે એ લેપચા છે. જુગારનો ચડસ એ લોકોને ધણો છે.

એ લતમાંથી એમને ભાગ્યે જ ખ્યાવી શકાય. લહેરી લાલા પણ એટલા જ. આજનું ખાવાનું મળે એટલે કાલની પરવા ન રાખે. આવા માણુસાને કામેકેમ લગાડી શકાય? કાલે કામે આવરો એવો ભરોસો તો એમના પર ભાગ્યે જ કોઈ રાખે.

તેઓ માને છે, કે સૃષ્ટિના જલપ્રલયમાંથી એક સ્ત્રી-પુરુષનું જોડું ખચી ગયું. તે હાજીંલિંગના ટેનડાંગ પર્વત પર આવી વસ્યું. આ જોડાની પ્રજ્ઞ તે લેપચાએ. એમને જુહી ભાષા છે. એમની ભાષામાં સાહિત્ય છે, પણ એમના એ સાહિત્યમાં એમના ધતિહાસનો આંકડોય નથી. રિષ્ટીઅનોએ એમના પ્રદેશ પર આકુભણું કૃયું. લેપચાએ હાર્યા એટલે એમની તિષ્ઠેટી ભાષાનો સ્વીકાર કરવો પડ્યો. અને તિષ્ઠેટીઅનોની માફક સ્ત્રી-પુરુષોને માથે ચોટલા રાખવાની ઝરજ પડી. આ તો એમની લોકવાયકામાંથી મળેલો ધતિહાસ છે. પરંતુ એમના રંગ, રૂપ અને ભાષાના અલ્યાસીએને તો જરૂર લાગે કે લેપચા તિષ્ઠેટના રહેવાસીએ હશે. અને ઘોંઢ ધર્મનો પ્રચાર તિષ્ઠેટમાં થયો તે પહેલાં તેઓએ દેશ છાડી સિકીમની પહાડી લૂભિમાં વાસ કર્યો હશે.

આ લેપચાંચો પણ ઠીંગણ્ણા છે. નાના હાથ, નાના પગ, અને લગભગ મૂછ વગરનો ચહેરો એટલે પુરુષો પણ સ્ત્રીઓ જેવા લાગે. તેઓને માયે કાળા મેશ જેવા વાળ હોય છે. સ્ત્રીઓ એ વાળને એ ચોટલે અને પુરુષો એક ચોટલે ગૂંઘે છે. જંગલના રહીશો રહ્યા એટલે જંગલનાં પશુપક્ષીઓનું એ સારું જ્ઞાન ધરાવે છે.

એમની એક જુદી જત તે લિંખુ લેપચાની છે. આમ બન્ને જતિઓ સરખી લાગે, પરંતુ ખારીક અવલોકન કરતાં જણાશે કે લિંખુએ અન્ય લેપચાંચો કરતાં શરીરે વધારે પીળા અને પાતળા છે. એમનો આંચો પણ વધારે નાની અને તિરછી હોય છે. ધરેણાં પહેરવાં અથવા કોઈ પણ જતના શાશુગાર સજવા એ આ લોકો સ્ત્રીઓનું કામ સમજે છે. એમનો પહેરવેશ તદ્દન સાદો છે. એમની સ્ત્રીઓની માન્યતા પણ એવી એટલે ભૂતિયા કે તિણીયન ખાઈએ માફુક એમને ધરેણાંનું ગાંડપણ નથી.

આ પહાડી પ્રજાઓ ખીણોના એતરોમાં એતી કરે છે, જંગલોમાં લાકડાં કાપે છે અથવા પર્વતોના ઢાળ પર આવેલા ચાના બાળોમાં નોકરી કરે છે.

ચાના બાળો

દાન્નિલિંગની આજુખાજુના દુંગરાએના

ઠોળાવો પર અસંખ્ય ચાના બાગો છે. ઈ. સ. ૧૮૫૬-૫૭થી એ બાગોની શરૂઆત થઈ. આજે સેંકડો મન્જૂરોને એ બાગો રોજ આપી રહ્યા છે. પરંતુ એ સર્વેની માલિકી યુરોપિયનોના હાથમાં છે. તેમાંથી એ પુષ્કળ કમાળી કરે છે.

### દાન્જિગર હીલ

હિમાલયનાં સર્વ શિખરોમાં જાંચામાં જાંચું શિખર તે માઉન્ટ એવરેસ્ટ છે. ૨૬૦૦૨ ફ્રીટની એની જાંચાઈ છે. એની ટોચ પર ચઢવાના સધળા પ્રયત્નો અત્યાર સુધી નિષ્કળ નીવડ્યા છે. આ અજેય શિખરને જેવાનું મન કોને ન થાય? દાન્જિલિંગથી સાતેક માઇલ દૂર આવેલ દાન્જિગર હીલ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે. એ ટેકરી પર જવાનો જંગલનો રસ્તો પણ ધણો સુંદર છે. તેમાં જ્યારે જંગલનાં કૂલ ખીલી રહ્યાં હોય છે ત્યારે એ ધણો! શોકી ઊંઠે છે. કાંચનબધાની માઝુક માઉન્ટ એવરેસ્ટ પણ સૂર્યાસ્ત અને સૂર્યોદય વખતે સૂર્યનાં ૨૦૦૫૦૦૦ કિરણાથી મનોહર લાગે છે. દાન્જિલિંગના દરેક મુસાફર આ દશયનાં સુક્તકર્ણે વખાણું કરે છે.

### સંગ્રહસ્થાન

દાન્જિલિંગનું સંગ્રહસ્થાન સરસ છે. આ

પ્રદેશનાં ભાતભાતનાં પક્ષીએ તથા રંગઘેરંગ|| પતં-  
ગિયાં અહીં જેવા મળે છે. એ જ પ્રમાણે અહીંના  
ઓટેનીક ગાડનમાં હિમાલયના પ્રદેશમાં થતી જુહી  
જુહી જતની વનસ્પતિનો સંગ્રહ છે.

આ સિવાય દાજીલિંગથી દૂર દૂરના પ્રવાસો  
પણ ગોઠવી શકાય છે. આ પ્રવાસોમાં રંગીન નહીં  
પરના જુલતા પ્રલનો પ્રવાસ, કલીમ્પોન્ગ, સંચાલ  
અને રંગેરુનનો સમાવેશ થઈ શકે. કુદરતી સૌન્હર્ય  
અને રખડપણીનો દણિએ એ ધણા મજાના થઈ  
પડે છે.

આમ દાજીલિંગમાં માધલો સુધી રખડવા  
છાંયડાવાળા વિશાળ રસ્તાએ છે, રમત ગમતનાં  
ધણુંથ સાધનો છે. એની હવા ખુશનૂમા અને  
તાજગીભરી છે. અહીંયાંથી હિમાલયનાં એવરેસ્ટ  
અને કાંચનલંધાનાં સુંદર દશ્યો જેવાનાં મળે છે.  
અને ધૂટે હાથે વેરેલા કુદરતી સૌન્હર્યનાં પણ અહીં જ  
દર્શાન થાય છે. આથી ખરેખર દાજીલિંગનાં જેટલાં  
વખાણુ કરીએ તેટલાં ઓળાં છે.

પ્રકાશક : શાંકુલાલ જગરીભાઈ  
ગૂર્જર અંથરતન કાર્યાલય,  
જાંધીરરતો અમદાવાદ.

મુદ્રક : ચતુરભાઈ શનાભાઈ પટેલ  
શ્રી મહેન્દ્ર સુદ્રણાલય, મામાની ફેલ્ટી  
શાક્યજાર—અમદાવાદ.

સાહસના સાહે અને થનગનતા પ્રાણે  
કુમાર જીવનનાં પરાક્રમોની સુંદર કથા

## જવાંમર્દ

લેખક : જયભિજણુ

રીંછની સાથે લડાઈ, ડાકુઓનો મેળાપ, બહારવટિયા  
યુદ્ધાસીંગ અને બઢો સાહેઅ ચંગનો આથ : સાહસોથી  
એક એક પૃષ્ઠ લરેલું છે. કીમત ૧। રૂપિયો.

એજ વાર્તાના બીજે ભાગ

## એક કંદમ બાગે

[ જવાંમર્દ ભા. ૨ ને ]

સાહસિકતાનો નાદ એ જુવાનોને હેઠોદ્વારની પ્રવૃત્તિ  
તરફ લઈ જાય છે. કથાનો નાયક કાંતિકાર ટોળીમાં લળી  
કેવાં પ્રયત્નો કરે છે, નાગ-ત્રિપુટીના પંજામાં કેવી રીતે  
પડે છે, આભ્યજીવનનાં કેવી રીતે દર્શન કરે છે : અને  
સુંદર ચિતાર : કી. ૧। રૂપિયો.

લગ્નો :

જૂન્ઝર ગ્રંથરત્ન કાર્યાલય

ગાંધીરસ્તો : અમદાવાદ,

બાળ ને કુમાર સાહિત્ય માટે અમારી

## ત્રણ ગ્રંથમાળાઓ



### વિદ્યાર્થી વાચનમાળા

ગુજરાતના ભશાડૂર લેખકોને હાથે લખાયેલી,  
ભારતવર્ષના મહાનપુરુષોની જીવનકથાઓઃ મહાન  
નગરોના સુંદર પરિચયોઃ                          પુસ્તકો : ૨૦૦



### ગૂર્જર બાળગ્રંથાવલિ

ભાળકોનું પ્રાણીજીવન, લૌગોલિક, ઐતિહાસિક  
તેમજ બીજું જ્ઞાન વધે તે ધરાદાથી સુંદર ચિત્રો  
સાથે વાતોના ઢબથી ચોંબાયેલી ગ્રંથાવલિ.



### કુમાર ગ્રંથમાળા

કુમારોને જ્ઞાન સાથે અમલ મળો, તે પ્રકારની  
સુંદર ગ્રંથમાલાની વિવરાની

સાચ્ચાઓઃ

ગૂર્જર ગ્રંથશિર્મંધીજ્ઞાયી લય

બાળકોને અમલવાદ કરની

## શાખી ઓણી

- ૧૧ શ્રી ગજનન  
૧૨ શ્રી કાતિકે  
૧૩ ચંદ્રહાસ  
૧૪ ભક્તન સુધન્વા  
૧૫ શ્રીહર્ષ  
૧૬ રસકવિ જગન્નાથ  
૧૭ અક્તન નામહેવ  
૧૮ શ્રીહેમવંદ્રાચાર્ય  
૧૯ છવપતિ શિવાળ  
૨૦ સમર્થ સ્વામી  
રામદાસ  
૨૧ આંધ્રીયી  
૨૨ ગુરુ નાનક  
૨૩ મહાત્મા કૃષ્ણ  
૨૪ ગૌરાંગ મહાગ્રસુ  
૨૫ લાલા લભ્યપતરાય  
૨૬ શ્રી ચિતરંજનદાસ  
૨૭ શ્રી નિખુનનદાસ  
ગનજર  
૨૮ શ્રી સુરેન્દ્રનાથ  
ઘેનરળ  
૨૯ શ્રી વિજયધર્મસ્સરિ  
૩૦ બાણુ રાજેન્દ્રપ્રેસાદ

## પાંચમી ઓણી

- ૮૧ પાર્વતી  
૮૨ શ્રીશંકરાચાર્ય  
૮૩ શ્રીમહ વલ્લભાચાર્ય  
૮૪ શ્રી માધવાચાર્ય  
૮૫ શ્રી રામાનુજાચાર્ય  
૮૬ મહારાજ કુમારધાળ

- ૮૭ ગુરુ ગોવિંદસિંહ  
૮૮ રઘુનિતસિંહ  
૮૯ લક્ષ્મીભાઈ  
૯૦ શ્રી કેશવબંદ્રસેન  
૯૧ શ્રી હિન્દુરચંદ  
વિવાસાયર  
૯૨ મહાદેવ ગોવિંદ  
રાનંડ  
૯૩ દાદાભાઈનિવેરેલ  
૯૪ શ્રી ગોપાલકૃષ્ણ  
ગોપલે  
૯૫ સ્વામી શ્રદ્ધાનંદજ  
૯૬ શ્રી ગોવર્ધનરામ  
૯૭ શ્રી જવાહરલાલ  
નેહરુ  
૯૮ સુલાપચંદ બોઝ  
૯૯ શ્રી સેનગુમા  
૧૦૦ તારામંડળ

- ૧૧૨ સ્વ. હાજુમહમ્મદ  
૧૧૩ વીર બધાવા  
૧૧૪ સૌર્ધ્યધામકાશમીર  
૧૧૫ નૈનિતાલ  
૧૧૬ મિરનાર  
૧૧૭ દારકા  
૧૧૮ પાટનાર દિલ્હી  
૧૧૯ મહેસુર  
૧૨૦ તાજમહાલ  
  
સાતમી ઓણી  
૪-૦-૦
- ૧૨૧ શ્રી ઋષલહેવ  
૧૨૨ ગોરક્ષનાથ  
૧૨૩ વીર દુણાલ  
૧૨૪ અકલરશાહ  
૧૨૫ મહામંત્રી મુન્નલાલ  
૧૨૬ કવિ દ્વારામ  
૧૨૭ જયકૃષ્ણ  
ઈદળ  
૧૨૮ શ્રી સયાજીરાવ  
ગાયકુવાડ  
૧૨૯ મહાવીરપ્રેસાદ  
દ્વિવી  
૧૩૦ મહાકવિ નાનાલાલ  
૧૩૧ પ્રે. રામમૂર્તિ  
૧૩૨ અભદ્રલગ્નારાખાન  
૧૩૩ સેરકી સતો  
૧૩૪ તેપાલ  
૧૩૫ મહાભોલ્દ  
૧૩૬ અમરનાથ  
૧૩૭ બદરી-કેદારનાથ  
૧૩૮ કલકતા  
૧૩૯ પાટણ  
૧૪૦ અતુપમ છિંગા

## છ્યારી ઓણી

- ૧૦૧ મહાદેવી સીતા  
૧૦૨ નાગાર્જુન  
૧૦૩ કર્મહેવી અને મેવા-  
કની વીરાંગનાચો  
૧૦૪ વીર વનરાજ  
૧૦૫ હૈદરઅલી  
૧૦૬ મહાકવિ પ્રેમાનંદ  
૧૦૭ સરટી. માધવરાબ  
૧૦૮ જામ રાધુંલત  
૧૦૯ જંકુભદ્ધ  
૧૧૦ શિદ્ધી કરમારકર  
૧૧૧ કવિ દ્વષ્પતરામ  
૧૧૨ કવિ દ્વષ્પતરામ


# વિદ્યાર્થી વાચન માળા

[ પુરિતકાળોના સર્વ દશ પ્રકાશને રવાધીન ]

દૂષ્ટક પુરિતકાની કી. ૦-૪-૦

આઠમી અણી	નવમી અણી	દશમી અણી
3-0-0	3-0-0	3-0-0
૧૪૧ ગુરુ હત્યાવય	૧૬૧ શ્રી માનહેવ	૧૮૧ શ્રી જોડનાથ
૧૪૨ ઉત્ત્યન-વન્સરાજ	૧૬૨ શ્રી સિદ્ધસેનહિવાદી	૧૮૨ દસ્તરત મહા
૧૪૩ મહાત્મા આનંદધન	૧૬૩ ઉપા. યશોવિજયશુ	૧૮૩ અશો. જરથુર
૧૪૪ વસ્તુપાલ-તેજપાલ	૧૬૪ વીર આલાશ	૧૮૪ અદદ્યાત્રાઈ
૧૪૫ સામગ્રભક્ત	૧૬૫ નાના ફિનવીસ	૧૮૫ ડૉ. અન્સારી
૧૪૬ કલિ નર્મદ	૧૬૬ શ્રદ્ધિજેન્દ્રલાલરેણ	૧૮૬ શ્રી રમેશચંદ્ર
૧૪૭ વાર સાવરકર	૧૬૭ રાજારામમોહનરાય	૧૮૭ વિજયાલક્ષ્મીપાંડિત
૧૪૮ જમણોદળ તાતા	૧૬૮ શ્રી અમૃતલાલકંઈ	૧૮૮ શ્રી કૃપણુમૂર્તિ
૧૪૯ કલિ કલાંપી	૧૬૯ પં. વિષણુદિગંભીર	૧૮૯ અંતકવિ પટ્ટિયાર
૧૫૦ પ્રો. સી. વી. રામન	૧૭૦ શ્રી રામાનંદેટરણ	૧૯૦ ચિત્રકાર રવિવમા
૧૫૧ શાહસોદાગરજમાલ	૧૭૧ અગવાનલાલ ઈંડલુ	૧૯૧ શ્રી શરેખાયુ
૧૫૨ શિલેંગ	૧૭૨ શ્રી પ્રકુલચંદ્ર રેણ	૧૯૨ સોરકના
૧૫૩ શ્રામતી કસ્તુરભા	૧૭૩ મૌ. અધ્યુલ કલામ	૧૯૩ બલારવિટ્યા
૧૫૪ દાર્ઢલીંગ	આઓ	૧૯૪ મોનીલાઈએમાન
૧૫૫ ઉતાકામંડ	૧૭૪ પાંચાલગોપાલાચારી	૧૯૫ આયુ
૧૫૬ જગન્નાથપુરી	૧૭૫ આયો	૧૯૬ શાનુંજ્ય
૧૫૭ કાશી	૧૭૬ આયો	૧૯૭ ગોમટેખિય
૧૫૮ જયપુર	૧૭૭ આયો	૧૯૮ અમદાવાદ
૧૫૯ હેદાબાદ	૧૭૮ આયો	૧૯૯ લખનૌ
૧૬૦ કાવેરીના જણધીએ	૧૮૦ આયો	૨૦૦ ગીરનાં જણલો

Serving JinShasan



005863

gyanmandir@kobatirth.org

પ્રકાશક : શાંભુવાલ જગથીભાઈ : ગુર્જર અંથરલ કાર્યાલય  
ગાંધીરસ્તો : અમદાવાદ.

મુદ્રક : જોવિદ્વાલ જગથીભાઈ : શારદા મુદ્રણાલય  
સુમા મર્સિજ